

-: અખબારી યાદી:-

## રાજકોટ મહાનગરપાલિકા આંગણવાડી ખાતે પુર્ણાદિવસ કાર્યક્રમની ઉજવણી કરાઈ

તારીખ: ૨૩-૦૬-૨૦૨૨

રાજકોટ શહેર આઈ.સી.ડી.એસ. વિભાગ રાજકોટ શહેરનાં બાળકોનું, કિશોરી, સગર્ભા, ધાત્રીનું પોષણ સ્તર વધે તે બાબતે સતત જાગૃત અને કાર્યરત રહે છે. બાળકો, સગર્ભા, ધાત્રી અને કિશોરી કે જે આવતીકાલનું સુરક્ષીત અને સ્વસ્થ ભવિષ્ય છે તેને ધ્યાનમાં રાખીને આંગણવાડી ખાતે મહિનાના ચાર મંગળવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન અને ઉજવણી કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ-૭૫ તેમજ સુસાશન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળવિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલ સુચના અનુસાર જુન માસના ત્રીજા મંગળવારે રાજકોટ શહેરના અર્બન ઘટક ૧, ૨, ૩માં કાર્યરત ૩૬૫ આંગણવાડી ખાતે તા.૨૧/૬/૨૨ના રોજ તમામ વર્કર બહેનોને બાળકોમાં પાયાનું શિક્ષણનું સ્તર વધે તે હેતુથી સરકારશ્રીની સુચના મુજબ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું.

બાળકોમાં શિક્ષણનું પ્રત્યારોપણ માતૃભાષાના માધ્યમથી વધુ અસરકારક કદ રીતે બનાવી શકાય તે હેતુથી રાજકોટ અર્બન ખાતેના કાર્યરત તમામ વર્કર બહેનોને પુર્વ પ્રાથમિક શિક્ષણની માહિતી તાલીમ આપવામાં આવેલ હતી. બાળકોને FUN WITH LEARN CONCEPT આધારીત તાલીમમાં ૬ વર્ષથી નાના બાળકોને પ્રેક્ટીકલ માધ્યમથી મળી રહે તે હેતુથી TEACHING & LEARNING METHOD નો શિક્ષણમાં કે રીતે ઉપયોગ કરી શકાય અને તેની વિશેષ સમજૂતી આપવામાં આવી વધુમાં પપેટ, પ્રોજેક્ટ કાફ્ટીંગ માધ્યમથી બાળકોને રસપુર્વક શિક્ષણ આપી શકાય તે બાબત જાણકારી આપવામાં આવી હતી. આંગણવાડીમાં બાળકોના આગમનથી માંડી અને બાળકોના નિગમન સુધી કદ પ્રવૃત્તીઓ કરાવવી જોઈએ તેનું સમયપત્રક બનાવી અને સમયપત્રક અનુસરવાની સુચના આપવામાં આવેલ હતી. બાળકોનામાં થયેલ વિકાસમાં ફેરફાર જાણવા માટે મારી વિકાસયાત્રા અને તેના ઉપયોગ વિષે સમજૂતી આપવામાં આવેલ હતી જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ અને બાળકોમાં મૌલિક ગુણોના વિકાસ પર ભાર મુકવામાં આવેલ હતો. વધુમાં બાળકના વિકાસ માટે PERENTING CONCEPT ના ભાગરૂપે બાળકોના RESALT CARD તૈયાર કરીને આપવાના વિષે જણાવવામાં આવેલ છે. સરકાર DIGITLAIZATION માં આઈ.સી.ડી.એસ. વિભાગ તત્પર રહે તે હેતુથી “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમની સમજૂતી આપવામાં આવેલ હતી.

બાળકોના સર્વાંગી વિકાસ માટે યોજાયેલ આ તાલીમને સફળ બનાવવા માટે આઈ.સી.ડી.એસ. અર્બન ઘટકના પ્રોગ્રામ ઓફીસર ઘટક ૧, ૨ અને ૩ના સી.ડી.પી.ઓ., ખુબ જહેમત ઉઠાવવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમની તાલીમ મુખ્યસેવીકા અને પ્રિ-સ્કુલ તાલીમ ઇન્સ્ટ્રક્ટર દ્વારા આપવામાં આવેલ હતી અને કુલ ૩૨૫ વર્કર બહેનોએ ઉત્સાહ પુર્વક આ તાલીમમાં ભાગ લીધેલ હતો.

(જન સંપર્ક અધિકારી)